

**B.Ed. Semester - 4 (CBCS) Examination**  
**March/April - 2025 (NEW COURSE)**  
**G-1 Accounting(Ssc - 5)**

Time: 1:15 Hours

Marks: 35

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ નીચેના પ્રત્યેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (૦૫)

- 1) જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે ?
- 2) પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે?
- 3) કંપનીને શેરના જાહેર ભરણા માટે કઈ સંસ્થાની સંમતિ લેવી પડે છે?
- 4) નાણાંકીય વિશ્લેષણ એટલે શું?
- 5) રોકડ પ્રવાહ એટલે શું?

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (૦૬ માંથી ૦૫) (૧૦)

- 1) કલ્પેશ, દિનેશ અને રાજેશનું નફા નુકશાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો RS. 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો.
- 2) ભાગીદારી પેઢીમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત કેવા સંજોગોમાં ઉદભવે છે ?
- 3) શેર જપ્તી એટલે શું ?
- 4) નાણાંકીય વિશ્લેષણના જુદા જુદા પ્રકારો જણાવો.
- 5) કાચા નફાનો ગુણોત્તર શોધો :

|               |               |                |              |
|---------------|---------------|----------------|--------------|
| વેચાણ         | RS. 20,00,000 | વેચાણ પરત      | RS. 2,00,000 |
| શરૂઆતનો સ્ટોક | RS. 2,50,000  | આખરનો સ્ટોક    | RS. 3,50,000 |
| ખરીદી         | RS. 12,00,000 | ખરીદીનાં ખર્ચા | RS. 50,000   |

- 6) કોઈપણ બે કામગીરી આવકના ઉદાહરણ આપો

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. (૦૬ માંથી ૦૫ ) (૨૦)

- 1) નફા નુકશાન ખાતું અને નફા-નુકશાન ફાળવણી ખાતાં વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
- 2) પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિબલો સમજાવો.
- 3) શેર એટલે શું ? શેરના પ્રકાર વિગતે સમજાવો.
- 4) નાણાંકીય વિશ્લેષણના ઉપયોગોની વિસ્તૃત ચર્ચા કરો.
- 5) ગુણોત્તર વિશ્લેષણના ચાર હેતુઓ સમજાવો.
- 6) કામગીરી પ્રવૃત્તિઓ એટલે શું? બિન નાણાંકીય કંપનીઓ અને નાણાંકીય કંપનીઓ માટે કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદભવતા રોકડ પ્રવાહના વ્યવહારો સમજાવો.

**ENGLISH VERSION**

Que-1 Answer the following questions. (05)

- 1) At the end of the year where will you transfer drawing account, in fixed capital account method?
- 2) Under which head goodwill is shown in the balance sheet?
- 3) For public issue of shares company has to take a permission from which organization?
- 4) What is financial analysis?
- 5) What is Cash Flow?

Que-2 Answer any five of the following questions in short. (05 Out of 06) (10)

- 1) The profit- loss sharing ratio of Kalpesh, Dinesh and Rajesh is 15:10:9. The total profit of the year of the firm is Rs. 68,000. Determine the share in profit of each partner.
- 2) Under what circumstances does the need for valuation of goodwill arise in a partnership firm?
- 3) What is meant by share forfeiture?
- 4) Describe the different types of financial analysis.
- 5) Determine Gross Profit Ratio:

|                |               |                    |              |
|----------------|---------------|--------------------|--------------|
| Sales:         | Rs. 20,00,000 | Sales Return:      | Rs. 2,00,000 |
| Opening Stock: | Rs. 2,50,000  | Closing Stock:     | Rs. 3,50,000 |
| Purchase:      | Rs. 12,00,000 | Purchase Expenses: | Rs. 50,000   |

- 6) Give illustration of any two operating incomes.

Que-3 Answer any five of the following questions in brief. (05 Out of 06) (20)

- 1) Distinguish between Profit and Loss account and Profit and loss Appropriation Account.
- 2) Explain the factors affecting to its valuation.
- 3) What is a Share? Explain in detail the types of shares.
- 4) Explain in detail the uses of financial analysis?
- 5) Explain four objectives of ratio analysis?
- 6) What is operating activities? Explain cash flow from operating transactions of non-finance companies and finance companies.

\*\*\*\*\*